

09 જુલાઈ 2018

2018 બ્રમ્પટન નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીની નોંધણી જુલાઈ 27ના રોજ અપોરે 2 વાગ્યે બંધ થશે

બ્રમ્પટન, ઓન્ટારિયો – શું બ્રમ્પટન સીટી હોલ, રિજન ઓફ પીલ અથવા શાળા મંડળ એટલેકે સ્કૂલ બોર્ડના ચૂંટાયેલ અધિકારીની ભૂમિકામાં તમને બ્રમ્પટનના લોકોની સેવા કરવાની ઈચ્છા છે?

ઉમેદવારો જેઓ બ્રમ્પટનની 2018 નગરપાલિકાની ચૂંટણીમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ પોતાનું નામાંકન 27 જુલાઈ 2018, અપોરે 2 વાગ્યા પૂર્વે નોંધાવી દેવાનું રહેશે.

સીટી નીચે આપેલ હોદ્દાઓ માટે નામાંકનો સ્વીકારશે:

- નગરપતિ (મેયર)
- પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર)
- શહેર પરિષદ સભ્ય (સીટી કાઉન્સિલર)
- નીચે આપેલ મંડળો માટે શાળા મંડળ ટ્રસ્ટી (સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી):
 - પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ
 - ડકેરિન-પીલ કેથોલિક ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ
 - કોસેઈ સ્કોલે કેથોલિક મોએવોનિર (અગાઉનું કોસેઈ સ્કોલે દ દીસ્ક્રીક્ટ કેથોલિક સાંથો-સુઈટ)

ઉમેદવારો માટેના નોમિનેશન ફોર્મ્સ એટલેકે નામાંકન પત્રો અને માહિતી પેકેજ બ્રમ્પટન સીટી હોલ ખાતે સ્થિત સીટી કલર્કના કાર્યાલય પર અને [ઓનલાઈન ઉપલબ્ધ](#) છે. ફોર્મ પોતે એટલેકે રૂબરૂમાં કાર્યાલયના નિયમિત સમય દરમિયાન સવારે 8:30 થી સાંજે 4:30 વચ્ચે અઠવાડિયાના દિવસોમાં, અને 27 જુલાઈ 2018, અપોરે 2 સુધી ફાઈલ કરવાના રહેશે. જુલાઈ 27ના રોજ અપોરે 2 પછી નામાંકનો સ્વીકારાશે નહીં.

ઓફિસ ઓફ રિજન ઓફ પીલ માટેના નામાંકનો રિજન ઓફ પીલ દ્વારા 10, પીલ સેન્ટર ડ્રાઈવ, બ્રમ્પટન ખાતે નિયમિત કામકાજના ક્લાકો દરમિયાન 27 જુલાઈ 2018, અપોરે 2 સુધી સ્વીકારવામાં આવી રહ્યા છે. કોસેઈ સ્કોલે વિઅમોન્ટ માટેના નામાંકનો સીટી ઓફ મિસિસોગા 300, સીટી સેન્ટર ડ્રાઈવ, મિસિસોગા દ્વારા નિયમિત કામકાજના ક્લાકો દરમિયાન 27 જુલાઈ 2018, અપોરે 2 સુધી સ્વીકારવામાં આવી રહ્યા છે.

ફાઈલ કરતી વખતે ફી (\$200.00 મેયર માટે અને અન્ય તમામ હોદ્દાઓ માટે \$100.00) રોકડા, ડેબિટકાર્ડ, પ્રમાણિત ચેક અથવા મની ઓર્ડર દ્વારા ચૂકવવાપાત્ર છે. અરજદારોએ નામ અને માન્ય સરનામાના પુરાવા પૂરા પાડવાના રહેશે. ફક્ત મૂળ દસ્તાવેજો સ્વીકારાશે; કૉપી અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સંસ્કરણોને મંજૂરી નથી. તમામ સંબંધિત ઉમેદવારોએ તેમના નામાંકન પત્ર અને નામાંકનને સમર્થનનું પત્રક (એન્ડોર્સમેન્ટ ઓફ નોમિનેશન ફોર્મ) ઝુંબેશના કોઈ પણ ફાળા પ્રાપ્ત કરતા પહેલા અથવા ચૂંટણી હેતુઓસર કોઈ પણ ભંડોળ ખર્ચતા પહેલા ફાઈલ કરી દેવાનું રહેશે. સ્કૂલ બોર્ડના ટ્રસ્ટી માટેના ઉમેદવારોએ એન્ડોર્સમેન્ટ ઓફ નોમિનેશન ફોર્મ ફાઈલ કરવું આવશ્યક નથી.

નામાંકન થયેલ ઉમેદવારોની યાદી નિયમિતરૂપે અદ્યતન થાય છે અને તે www.brampton.ca/BramptonVotes પર ઉપલબ્ધ છે.

તૃતીય પક્ષ જાહેરાતકર્તા નોંધણીઓ 19 ઓક્ટોબર 2018 સુધી ફાઈલ કરી શકાશે.